

B.Com. Semester - 1 (CBCS) Examination
Feb/Mar. -2021 (OLD COURSE)
PRINCIPLES OF MICRO ECONOMICS - 1(CORE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું? ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૨ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતાં પરીબળો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૩ ઘટતા મળતરનો નિયમ ઉદાહરણ અને આકૃતિ સહિત સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૪ ટૂંકા ગાળામાં ખર્ચ, ઉત્પાદન દર વચ્ચેનો આંતર સબંધ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૫ કોઈપણ બે પ્રશ્ન સમજાવો. (૧૪)
1. વટાવનો સિધ્ધાંત સમજાવો.
 2. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેના પ્રકારો જણાવો.
 3. પેઢી વિકાસનાં લાભ જણાવો.
 4. ટૂંકનોંધ લાખો. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ.

ENGLISH VERSION

- Q.1 What is Business Economics? Explain the nature and scope of Business Economics. (14)
- Q.2 Explain the factors affecting elasticity of demand. (14)
- Q.3 Explain the law of Diminishing Return with the help of diagram and illustration. (14)
- Q.4 Explain the inter-relationship between cost and production rate in short run. (14)
- Q.5 Explain any two questions. (14)
1. Explain the principle of Discount.
 2. What is elasticity of demand? State its types.
 3. Advantages of expansion of firm.
 4. Write short notes. Fixed cost and variable cost.
